

આઈઆઈટી-ગાંધીનગરના બી.ટેકના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં કોમ્યુનિટી કોમ્યુનિકેશન પ્લેટફોર્મ 'ફ્લટર' મોબાઇલ એપ બનાવી છે, જેનો ઉપયોગ નિરમા, આઈઆઈટી, પીડીપીયુ, વિશ્વકર્મા એલ્બિ.ના વિદ્યાર્થીઓ પણ કરી રહ્યાં છે.

સ્ટુડન્ટ્સ 'ફ્લટર'થી રહે છે કનેક્ટ

STUDENT INNOVATION

સિટીરિપોર્ટર • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરના બી.ટેક સ્ટુડન્ટ્સે કોમ્યુનિટી કોમ્યુનિકેશન પ્લેટફોર્મ 'ફ્લટર' મોબાઇલ એપ તૈયાર કરી છે. કેમ્પસમાં 500 જેટલાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફ વગેરે હોવા છતાંય દરેકની એકબીજા સાથે વાતચીતની શક્યતા થતી નથી, ત્યારે આ મોબાઇલ એપ્લિકેશનનાં પ્લેટફોર્મ પર પોતાની ઓળખ છતી થયાં વગર લોકો પોતાનાં મંતવ્યો, સૂચનો વ્યક્ત કરી શકે છે તેમજ વાતચીત કરી શકે છે. આ એપને પોલતાં તેમાં ઈન્સ્ટિટ્યુટ્સનું વિસ્ત બહાર આવે, ત્યારબાદ પોતાની ઈન્સ્ટિટ્યુટમાં



• ફ્લટર એપ ડિઝાઇન કરનાર આઈઆઈટી-જીએનના સ્ટુડન્ટ્સ

જતાં તેમાં એક અલગ જ નામ સાથે 'ફ્લેપ' એટલે કે કમેન્ટ્સ કરી શકાય છે. ત્યારબાદ તેમાં કોઈ 'ફ્લેપબેક' કરીને કોમેન્ટનો રિપ્લાય આપી શકે છે. આ મોબાઇલ એપ હાલ એન્ડ્રોઇડ ફોનમા ડાઉનલોડ કરી શકાય છે.

આ એપને ડિઝાઇન કરવામાં અને ચલાવવામાં પંકજ ગૌતમ, રાજેશ પાટિદાર, શિવમમણી ત્રિપાઠી અને ઉજ્જ્વલ દવેએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ વિશે માહિતી આપતાં ઈલે.એન્જિનિયરિંગના વિદ્યાર્થી

અને ફ્લટરએપનાં ફાઉન્ડર પંકજ ગૌતમે જણાવ્યું કે, ઈન્સ્ટિટ્યુટ્સમાં વિદ્યાર્થીઓ પોતાનાં સિલેક્ટેડ ગ્રુપમાં જ રહેતાં હોય છે, જ્યારે 300-400 વિદ્યાર્થીઓ કે સ્ટાફની સાથે ક્યારેય અંગત વાતચીત થતી નથી. એટલે અભ્યાસ, ભવિષ્યની તકો, કેમ્પસનાં સૂચનો વગેરે વિશેની વાતચીત કરવા માટે એક પ્લેટફોર્મની જરૂર હતી. વિદ્યાર્થીઓની સમસ્યાઓ ફેસબુક કે ટ્વિટરથી સોલ્વ થઈ શકતી નથી એટલે 'ફ્લટર' ડિઝાઇન કરવાનો અમે નિર્ણય લીધો. હવે આ એપને અમે ચાર યુનિવર્સિટીઝમાં એપ્લાય કરી ચૂક્યાં છે અને આ પ્લેટફોર્મ પર આઈઆઈએમ અને એનઆઈટીને પણ લાવવાનો વિચાર ચાલી રહ્યો છે.

કોઈ ખરાબ કોમેન્ટ આપે તો તે ડિલિટ થઈ જાય



થાય છે. તેમજ ઓળખ છતી થયાં વગર વાતચીત થતી હોઈ, કોઈપણ ગંદો કે ખરાબ ફ્લેપ મૂકે તો તેમાં 'અપવોટ' અને 'ડાઉનવોટ'નું ફીચર આપવામાં આવ્યું છે. જેમાં કોઈ વિદ્યાર્થીએ ખરાબ કોમેન્ટ કરી હોય તો ત્રણ વ્યક્તિ તેને ડાઉન વોટ આપે તો તે થોડી વારમાં આપોઆપ ડિલિટ થઈ જાય છે. જેથી આ એપથી કોઈ તેનો દૂરઉપયોગ ન કરી શકે.

શિવમ મણી ત્રિપાઠી, આઈઆઈટી સ્ટુડન્ટ, ફ્લટર એપ ફાઉન્ડર.

અમે આ ફ્લટર એપને 12મી જૂને લોન્ચ કરી અને અત્યાર સુધી 530 ડાઉનલોડ્સ થઈ ચૂક્યાં છે. તેમજ 250 જેટલાં એક્ટિવ યુઝર્સ છે. તેમજ આઈઆઈટી-જીએનનાં 190થી 200 જેટલાં વિદ્યાર્થીઓ આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. આ એપ દ્વારા પોતાની ઓળખ છતી કર્યા વગર વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ કહે છે અને સિનિયર્સ આ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ઘણી વખત ઈન્ટર્નશિપ ક્યાં કરવી, એડમિશન્સ ક્યાં લેવાં, સ્કોલરશિપ ક્યાંથી મેળવવી વગેરે માટેનાં સલાહ-સૂચનોની વાતચીત

MOTHERBOARDS & LAPTOPS REPAIRING

@ 199*

Specialist in Desktop/Laptop Chip Level Repairing - Admission Open 2015-16

FREE TABLET*
With Training

Best Quotes for dealers of Laptop Motherboard, Hinges, Laptop Accessories, LCD/LED, Keyboard, IC.

Dealer Enquiry Solicited, Bulk Motherboard Repairing For Dealers

CONTACT US
Mo.: 8866077280 Email: pkvcorporation@gmail.com Web: pkvcorporation.com